


૧૬ સપ્ટેમ્બર ૨૦૨૦ વોલ. ૧ નં. ૧૨
ભાગંતર કરેલ સંક્રણ

ગ્રાહક સાથી

ઓઝોનનાં સ્તરમાં ગાંભડું આપણાને કષ રીતે અસર કરે છે



(વાંચવા માટે કિલિક કરો)



- ઓઝોનનાં સ્તરમાં ઘટાડાની તમારા પર કેવી અસર થાય છે
- ઓઝોન ફેન્ડલી ઉત્પાદનો વાપરો
- સીઇઆરસીએ જગૃતિ ફેલાવીને ઓઝોન ડેની ઉજવણી કરી



CONSUMER EDUCATION AND RESEARCH CENTRE
AHMEDABAD

HELPLINE NO. 1800 233 0222

CERC nos. 079-27489945/46/49, 48905898, 48906898

Email : cerc@cercindia.org, grahaksathi@cercindia.org



ઓગ્રોના સ્તરમાં ઘટાડાની તમારા પર કેવી અસર થાય છે

ઓગ્રોન શું છે?

ઓગ્રોન એવો ગેસ છે જે વાતાવારણના બે સ્તરોમાં ફુદરતી રીતે મળે છે:

૧) ટ્રોપોસ્ફીરમાં પૃથ્વીની સપાટીથી લગભગ ૧૦થી ૧૫ કિલોમીટર સુધીની સપાટીમાં ૧૦ ટકા ઓગ્રોન હોય છે. પૃથ્વીની સપાટી નજીકનાં વધારાના ઓગ્રોનને 'બેડ ઓગ્રોન' કહેવામાં આવે છે કારણ કે, તે જીવન માટે નુકસાનકારક છે.

૨) સ્ટ્રેટોસ્ફીરમાં એ ટ્રોપોસ્ફીરથી ઉપર ૫૦ કિલોમીટર સુધી માં પૃથ્વીનું ૬૦ ટકા સુધી ઓગ્રોન હોય છે. અને તેને 'ગુડ ઓગ્રોન' કહેવામાં આવે છે કારણ કે, તે સુર્યના નુકસાનકારક અભ્રાવાચ્યોલેટ (UV) રેડિયેશનના મોટા ભાગના હિસ્સાને શોષી લે છે.

ઓગ્રોન સ્તર શું છે?

ઓગ્રોન સ્તર એ ઓગ્રોન ગેસનું કવચ છે જે સુર્યના નુકસાનકારક અભ્રાવાચ્યોલેટ કિરણોથી પૃથ્વીના જીવનનું રક્ષણ કરે છે.

ઓગ્રોન હોલ શું છે?

ઓગ્રોન હોલ એટલે ઓગ્રોન સ્તર પાતળું થવાની પ્રક્રિયા. પૃથ્વી પર માનવીય પ્રવૃત્તિ ને કારણે ઓગ્રોન ગેસ છુટવામાં ઘટાડો થવાથી આ સ્થિતિ સજ્જિય છે.

મોન્ટ્રીયલ પ્રોટોકોલ શું છે?

ઇ મોન્ટ્રીયલ પ્રોટોકોલ એ ૧૯ સપ્ટેમ્બર ૧૯૮૭નાં રોજ કરવામાં આવેલી આંતરરાષ્ટ્રીય સંધિ છે, જેનો હેતુ ઓગ્રોનના ઘટાડા માટે જવાબદાર રસાયણોના ઉત્પાદન અને વપરાશ (કલોરોફ્લોરોકાર્બન્સ, હેલોન્સ વગેરે)ને નાખૂં કરવા પગલાં ભરીને ઓગ્રોનના સ્તરનું રક્ષણ કરવાનો છે.

ઓગ્રોન કે શું છે?

દર વર્ષ કું ૧૬ સપ્ટેમ્બરને ઓગ્રોન કે તરીકે ઉજવવામાં આવે છે. ચુઅને ૧૮ ડિસેમ્બર ૧૯૮૭નાં રોજ ૧૬ સપ્ટેમ્બરને 'ઇન્ટરનેશનલ કે ફોર દ્વારા પ્રીર્જર્વેશન ઓફ દ્વારા ઓગ્રોન લેયર' તરીકે જાહેર કર્યો હતો.


ઓગ્રોન સ્તરમાં ઘટાડાની અસર

- માનવ પર : ચામડીનું કેન્સર, નાની ઉમરમાં ચામડી વૃદ્ધ જેવી દેખાવી, રોગપ્રતિકારક શક્તિ પર અસર, મોતિયો, આંદણાપણું, હૃદય અને ફેફસા ખરાબ થવા
- વૃક્ષો પર : વૃક્ષીય પર અવરોધ, પાકની ગુણવત્તા પર અસર અને ઉપજમાં ઘટાડો, મોસમી પાક અને જમીનનું દોવાળા.
- પ્રાણીઓ પર: જળમાં થતી વનસ્પતિ પર અસર, દર્દિયાધ જીવો અને જૈવીક રસાયણો પર અસર કરે છે.

ઓગ્રોનના ગાબડાં ને કઈ રીતે પૂરવા

ઓગ્રોનના ગાબડાંને પુરવાનો એકમાત્ર માર્ગ વાતાવારણમાં કલોરોફ્લોરોકાર્બન્સ (CFCs) અને ઓગ્રોન ઘટાડતા પદાર્થો (ODSs)ને નીકળતા રોકવાનો છે. દરરોજ વપરાતા કોલસા, લાકડા જેવા દંધણાનો વપરાશ અને ઔદ્યોગિક પ્રવૃત્તિ એ આ પ્રદુષણાના મોટાં સ્નોત છે.

ઓગ્રોન સ્તરનું રક્ષણ કરવા માટે ODSs નું ઉત્પાદન અને વપરાશ પર અંકુશ કારા મોન્ટ્રીયલ પ્રોટોકોલ હેઠળ કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય પ્રયાસો સફળ રહ્યા છે. ODSs જમા થવાનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે અને ઓગ્રોન સ્તર પૂર્વવત થવાનો પ્રથમ સંકેત દર્શાવી રહ્યું છે. જો કે, આ સદીના મધ્ય સુધીમાં સ્થિતિ સંપૂર્ણ રીતે પૂર્વવત થાય તેવી સંભાવના નથી કારણ કે, વાતાવરણમાં ODSs અનેક વર્ષો સુધી રહે છે અને નુકસાન કરવાનું ચાલુ રાખે છે.





ઓગ્રોન ફેન્ડલી ઉત્પાદનો વાપરો

ઓગ્રોનનું પ્રમાણ ઘટાડતાં ઉત્પાદનો, ઓગ્રોનના સ્તરને ઘટાડવાનું કારણ બની શકે છે. ઓગ્રોનને ઘટાડે તેવા રસાયણોથી બનેલા ઉત્પાદનો ન ખરીદો.

ઓગ્રોન ઘટાડતા પદાર્થો - કલોરોફ્લોરોકાર્બન્સ (CFCs), હાઇઝ્રોકલોરોફ્લોરોકાર્બન્સ (HCFCs), હાઇઝ્રોભ્રોમોફ્લોરોકાર્બન્સ (HBFCs), હેલોન્સ મીથાઇલ બ્રોમાઇડ, કાર્બન ટેટ્રાકલોરાઇડ, મિથાઇલ કલોરોફોર્મ.

જેમાં ODSs નો ઉપયોગ થતો હોય તેવા ઉત્પાદનો - એર કન્ડીશનર્સ અને રેફ્રિજરેશન, આગને કાબુમાં લેવામાં વપરાતા સાધનો, બોડી સ્પે, ઇમ ફેશનર્સ, હેર સ્પે, નેસલ ઇનહેલર (નાકમાંથી શ્વાસ લેવા માટેનું સાધન) જેવા સ્પેથી હવામાં પ્રવાહી ફેલાવતા સાધનો. ફૂષિ વપરાશ માટેનાં રસાયણો, ફીણ ફેલાવતા તત્વો, ઔદ્યોગિક સોલ્વન્ટ્સ અને સફાઈ માટેનાં સોલ્વન્ટ્સ (દ્રાચ કિલિનિંગ સહિત).

ODSs ના પર્યાવરણાલક્ષી વિકલ્પો

- હાઇઝ્રોફ્લોરોકાર્બન્સ (HFCs)
- પફ્લ્યુર્ચોકાર્બન્સ (FCs)

ઓગ્રોન ફેન્ડલી ગ્રહક બનો

- ઓગ્રોન ફેન્ડલી અથવા તો CFC મુક્ત હોય તેવા એરોસોલ સ્પે, રેફ્રિજરેશન, એરકન્ડીશનર્સ અને અભિનશામક સાધનો ખરીદો. તેમાં CFCs, HCFCs અથવા હેલોન્સ જેવા ઓગ્રોનનાં પડને નુકસાન કરતાં પદાર્થો ન હોવા જોઈએ.
- જો તમે CFCs મુક્ત ન હોય તેવા કેટલાંક ઉપકરણોની માલિકી ધરાવતા હો તો નિયમિત રીતે તેની સર્વિસ કરાવો કારણ કે, કોઇ પણ પ્રકારની ખરાબીથી CFCs વાતાવરણમાં પ્રસરી શકે છે. આ ઉપરાંત, નિયમિત રીતે તમારી કાર, ઘરનું એસી અને રેફ્રિજરેટર તપાસો અને લીક હોય તો તાત્કાલિક રિપેરિંગ કરાવો.
- તમારા જૂના ઉપકરણોનો નિકાલ કરતી વખતે એ વાતની ખાસ કાળજી રાખો કે, કુલિંગ સરકિટને કોઇ નુકસાન ન થાય કારણ કે, આ સરકિટમાં ODSs હોય છે. એ વાતની ખાતરી રાખો કે નિષ્ણાંત ટેકનિશિયન જ ઉપકરણમાંથી ODSs કાઢે અને તેનું દિસાઇકલિંગ કરે. આ રીતે વાતાવરણમાં પ્રદૂષણ થતું અટકશે.
- ODSs સમાવતા જૂના ઇન્સ્યુલેશન ફોમમાં પર્યાવરણની રીતે જોખમી કચરો હોવાથી તેનો નિકાલ કરી દેવો જોઈએ.
- પોલિથીન કે પછી પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું સંપૂર્ણપણે ટાળો.
- સફાઈ માટે પરંપરાગત રીતે વપરાતી ચીજેનો ઉપયોગ કરો. રસાયણોથી બનેલા ઉત્પાદનોનો ઉપયોગ ન કરો કારણ કે, તેમાં ODSs હોય છે અને તમારા આરોગ્યને હાનિકારક પણ હોય છે.
- શક્ય હોય ત્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટ અથવા કારપુલિંગનો ઉપયોગ કરો. ઓગ્રોનના સ્તર માટે વાહનોનું પ્રદૂષણ નુકસાન કારક છે.
- રાસાયણિક ખાતરના ઉત્પાદન દરમિયાન ઉત્પણ્ણ થતા ગ્રીનહાઉસ ગેસ પણ ઓગ્રોનના સ્તરના ઘટાડાનું કારણ બને છે. આવા ખાતરનું ઉત્પાદન ટાળો, તેને બદલે ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરો.



સીઇઆરસીએ જાગૃતિ ફેલાવીને ઓર્જોન ડેની ઉજવણી કરી

ઓર્જોનના સ્તરમાં ઘટાડાની અસર પૂછ્યી પર માનવ, વૃક્ષો અને પ્રાણી જીવન પર પડે છે કારણ કે ઓર્જોનના સ્તરમાં ઘટાડો થવાથી સુર્યનું નુકસાનકારક અલ્ટ્રાવાયોલેટ રેડિએશન આપણા સુધી પહોંચે છે. માનવ પ્રવૃત્તિને કારણે ઓર્જોનમાં ઘટાડો થાય છે. આ ઘટાડો મયરીદિત કરવા અથવા અટકાવવા આપણે શું કરવું જોઈએ અને શું કરી શકીએ તે અંગે જાગૃતિ ફેલાવવી મહત્વની છે. આ મુદ્દા પર દ્વારા કેન્દ્રીત કરવા વૈશ્વિક સ્તરે ૧૬ સપ્ટેમ્બરને ‘દી ઇન્ટરનેશનલ ડે ફોર દી પ્રીર્જર્વેશન ઓર્જોન લેચર’ અથવા તો ‘વર્ક ઓર્જોન ડે’ તરીકે મનાવવામાં આવે છે.

દર વર્ષ CERC ENVIS રિસોર્સ પાર્ટનર (MoEF&CC) આ દિવસે આ વિષય પર જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. ૨૦૧૮માં શાળાના બાળકો સાથે ઓર્જોન ડે મનાવવામાં આવ્યો હતો. આ અંગે જાગૃતિ ફેલાવવા પ્રેરણને તૈયાર કરવામાં આવ્યું હતું અને સવાલ જવાબની સ્પર્ધા યોજવામાં આવી હતી. વિજેતાઓને ધનામ વિતરિત કરવામાં આવ્યા હતા. ઓર્જોન અંગે જાગૃતિ ફેલાવવા વર્ક ઓર્જોન ડેના પોસ્ટર અને બેનર પણ તૈયાર કરવામાં આવ્યા હતા.

આ વર્ષ કોવિડ મહામારીને દ્વારા રાખતાં તમામ જાગૃતિ કાર્યક્રમો ઓનલાઇન અથવા તો વર્ચ્યુઅલી યોજવામાં આવ્યા હતા.

- વર્ક ઓર્જોન ડે નિમિત્તે ‘ઓર્જોન ફોર લાઇફ’ વિષય પર વેબિનાર યોજવામાં આવ્યો હતો. એમ એસ ચુનિવર્સિટીના ડૉ. મંથન ટેલર ‘ઓર્જોનના સ્તરના રક્ષણ અંગેની સંદિ અને સત્તાવાર પ્રક્રિયા’ પર બોલ્યા હતા. નવરચના ચુનિવર્સિટીના ડૉ. કરણ રાણા ઓર્જોનને અનુકૂળ ઉત્પાદનો પર બોલ્યા હતા. વેબિનારમાં વિજ્ઞાનીઓ, સંશોધકો અને વિદ્યાર્થીઓ સહિત ૧૦૦થી વધુ સહભાગીઓ જોડાયા હતા.
- ઓનલાઇન ક્રિએટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને ૧૪૬૫થી વધુ સહભાગીઓ દ્વારા અભૂતપુર્વ પ્રતિસાદ સાંપડયો હતો.
- વધુ જાગૃતિ માટે ઓર્જોનને ઘટાડતા પદાર્થો (ODSs) અને તેના પુરકો અંગે પોસ્ટર અને ઇન્ફો-ગ્રાફિક તૈયાર કરવામાં આવ્યા હતા.
- સીઇઆરસીના કર્મચારીઓ માટે ઇન-હાઉસ જાગૃતિ કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં ઓર્જોનના સ્તરના રક્ષણ અંગેના વિડિયો, પોસ્ટર્સ તથા ઇન્ફો-ગ્રાફિક્સ દર્શાવવામાં આવ્યા હતા.



Links to our recent issues

1. કોરોનાથી સંરક્ષણની ભામક જાહેરાતો - દ્વારા આપે
2. નાબળુ સ્વાસ્થ્ય ધરાવતી વ્યક્તિઓ માટે કોરોનામાં લેવાતી સંભાળ
3. ઇનહેલર્સ ખરીદવા માટેની માર્ગદર્શિકા
4. કોવિડ - ઘરેલુ દાક્તરી સારવાર
5. કોવિડના સમયમાં ટેકનોલોજીની સહાય